


બાળકો અને  
નવયુવાનો માટે

મોહર્રમ, હીજરી સન ૧૪૩૫,  
ડીસેમ્બર - ૨૦૧૩



અંક  
૬૨

الإمام الحسين (ع)



રૂ.  
30/-





# અલી અ.સ.નો શીઆ

(હપ્તો-૧૧)

**અમારા ધ્યેયના રક્ષકો :**

મૌલાએ કાએનાત અ.સ.એ ઈશાદિ ફરમાવ્યું છે કે : અમારા પ્રેમના રાહમાં અમારા શીઆઓ એક બીજા સાથે બખ્ષિશ અને દાનવીરતાનો વ્યવહાર રાખે છે.

અમારી સાથેના તેમના પ્રેમને લીધે તેઓ એક બીજા સાથે પણ પ્રેમપૂર્વક વર્તે છે.

અમારા ધ્યેય અને લક્ષ્યને અમર રાખવા માટે એક બીજા સાથે હળે મળે છે. (સંપથી રહે છે.)

એ લોકો એવા (સ્વભાવના) હોય છે કે તેઓ ક્રોધિત થાય તે સંજોગોમાં પણ ક્રોધની ઉપર અત્યાચાર નથી કરતાં અને ક્રોધના ઉપર પ્રસન્ન થઈ જાય તો પણ (પ્રસન્નતાના અતિરેકમાં) મર્યાદા નથી ઓળંગતા.

પોતાના પાડોશીઓ માટે બરકતવાળા (પુણ્યશાળી - લાભ પહોંચાડનાર) અને પોતાના સાથીઓ માટે શાંતિ અને સલામતિરૂપ હોય છે.  
(કાફી. ભાગ-૪)





بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## એરે સરપરસ્તી હમરતે હુજજત

અરવાહોના ફિદાહ, અજજલલ્લાહો તઆલા ફરજહુશરીફ

મર્હુમ જનાબ મોલાના આબીદ હુસૈન રીઝવી

સાહેબની યાદમાં

ધર્મ પ્રચારક-પ્રખર વિદ્વાન-કૌમના સંનિષ્ઠ સેવક :

આલી જનાબ મુખ્તારઅબ્બાસ વસાયા

મુદ્દિલ્લહૂની નિગરાનીમાં

મુખ્ય તંત્રી :

સૈયદ મોહમ્મદ રઝા ગરવી

કાર્યવાહક તંત્રી :

સૈયદ મોહમ્મદ અખ્તર

સહાયકો :

અહમદ રઝા મુરારહ

તાલીમરઝા અજમેરી

એહસાનઅલી રીઝવી

અનુવાદક :

સૈયદ મોહમ્મદ ફાઝિલ બુખારી

આઈ.એ.એસ. (નિવૃત્ત)

શુષોભન :

(Skype Graphics) સાજુદ પંજ

9898013082

E-mail : sajidpanj@yahoo.in

વિગતો માટે સંપર્ક :

યુરોપ, અમેરીકા અને કેનેડા માટે :

અહ્લાજ મુખ્તાર અબ્બાસ સાહબ વસાયા

Mukhtar Abbas Vasaya

91, Longthronton Road, LONDON, SW 16 5QF

Tel. : 0044 - 2082866198 Mo.: 00447828958746

E-mail : movasaya@hotmail.com

ભારત, પાકીસ્તાન, આફ્રીકા, રિયુનીયન માટે :

હૌઝએ ઈલમીયહ ઈમામ ખુમૈની (રહ.)

ગોલ્ડન પાર્ક, વટવા, અમદાવાદ. ગુજરાત. ભારત - ૩૮૨૪૪૦

ફોન : ૦૭૯-૨૫૮૯૨૭૮૬, ૯૪૨૬૬૭૮૬૧૪, ૯૪૨૬૬૭૮૬૧૨, ૯૭૨૪૭૩૭૮૬૫

E-mail : hadimasik@yahoo.com

Website : www.hadikids.org

મોહર્રમ, હીજરી સન ૧૪૩૫,

ડીસેમ્બર - ૨૦૧૩

## બઈસ્મેહી સુબ્હાનહૂ તઆલા

વહાલા બાળકો !

અસ્સલામો અલયકુમ !

મહોર્રમ માસ એ મહીનો છે જેમાં તલવાર ઉપર રક્તએ ફેટેહ મેળવી હતી અને એ સાબિત કરી દીધું છે કે ઈસ્લામ પોતાનું ખૂન વહેવડાવવાથી ફેલાયો છે, અન્યોના રક્ત વહેવડાવવાથી નહીં, એટલે કે ઈસ્લામ તલવારના જોરે નથી ફેલાયો - શક્તિ અને બળપ્રયોગથી ઈસ્લામ ફેલાયો નથી તે હકીકતની ઉજ્જવળ અને સ્પષ્ટ સાબીતી કરબલા છે.

વહાલા બાળકો ! આશૂરાના બોધપાઠો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરજો - અને અઝાદારીમાં લેશમાત્ર પણ આળસ કરતાં નહીં. આપણું અસ્તિત્વ અઝાદારીના અસ્તિત્વ સાથે સંકળાયેલું છે અને આખેરતની સફળતા અને ત્યાં પણ માથું ઉંચકીને ચાલી શકીએ તેનો આધાર પણ અઝાદારી ઉપર જ છે.

અને ઈમામ હુસૈન અ.સ.એ પોતાનું, પોતાના સગાવહાલા અને મિત્રો અને મદદગારોનું લોહી પેશ કરીને, એટલે સુધી કે છ માસના નિર્દોષ બાળક સુધ્ધાનું બલિદાન આપીને હંમેશ માટે ઈસ્લામના અસ્તિત્વને અમર કરી દીધું છે.

ઈમામ ખુમૈની (રહ.)નું ફરમાન છે કે એ મોહર્રમ અને સફરના મહીનાઓ છે કે જેનાથી ઈસ્લામને જીવન પ્રાપ્ત થયું છે.

ઈમામે માઅસૂમનો ઈર્શાદ છે કે 'હુસૈનની કતલ મોઅમેનીનના હૃદયની એ ઉખા અને ગરમી છે જે કદીયે ઠંડી નહીં પડે.'

તેથી અઝાદારીના આપણાં જુસ્સામાં કમી આવવી જોઈએ નહીં.

વહાલા બાળકો ! અઝાદારી એ ફક્ત કોઈ રિવાજ નથી પરંતુ અઝાદારી એક ધ્યેય-લક્ષ્યાંક-મિશન છે. જેનો પાયો જનાબ ઝયનબ સલા. અને સૈયદે સજ્જાદ અ.સ.એ શામના કેદખાનામાં નાંખ્યો હતો અને એ હકીકતની જાહેરાત કરી દીધી હતી કે અત્યાચારી કોણ છે અને અત્યાચાર વેઠનાર કોણ છે, તે જગત જોઈ લે અને ઓળખી લે.

અમે અમારી વહાલી બહેનોને પણ ગુઝારિશ કરીએ છીએ કે જનાબ સકીના સલા. ના ધ્યેયને પણ ભૂલી ન જાય. જનાબ સકીના સલા.એ કરબલા અને શામમાં ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેનાથી શત્રુઓની હારનું કારણ ઉપસ્થિત થયું હતું. પરદાની રક્ષા કરી હતી અને ધીરજ અને સહનશક્તિના પાઠ સર્વત્ર કર્યા છે.

વસ્સલામ

વાર્ષિક લવાજમ

રૂ. ૩૦૦/-



## ઈમામ હુસૈન અ.સ. પ્રત્યે શોક વ્યક્ત કરવાનો (અઝાનો) શિષ્ટાચાર (આદાબ)

હદીસે કુદસીમાં છે કે “પરવરદિગારે આલમે જનાબ મૂસા અ.સ.ને સંબોધીને ફરમાવ્યું : હે મૂસા ! જે વ્યક્તિ મારા પ્રિય નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સ.અ.વ.ના ફરઝન્દના શહાદતના દિવસોમાં રડશે અથવા પોતાને રડતી વ્યક્તિ જેવો બનાવશે અને તેમની મુસીબતો પ્રત્યે સંવેદના અને શોક વ્યક્ત કરશે તે વ્યક્તિ જન્નતમાં જશે.”

(મુસ્તદરક-સફીનતુલ-બિહાર ભા.૭ પા.૨૩૫)

ઈમામ સાદિક અ.સ.એ ફરમાવ્યું છે કે “તમે લોકો મજલિસો કરો છો તે મને ગમે છે અને તમે પોતાની મજલિસોમાં અમારા ધ્યેયને જીવિત રાખો અને ખુદાવન્દે આલમ એ વ્યક્તિ ઉપર રહેમત કરે જે અમારા ધ્યેયને જીવિત રાખે.”

(વસાએલુશીઆ ભા.૧૦ પા.૨૩૫)





ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે કે “આશુરાના દિવસે મનોરંજન આપનારા કાર્યો કરવા જોઈએ નહીં અને શોક વ્યક્ત કરવો જોઈએ (અઝાદારી કરવી જોઈએ) સૂર્ય મધ્યાહને પહોંચે અને તેનાથી પણ આગળ વધે ત્યાં સુધી ભોજન અને પેય વસ્તુઓનો (ખાણી-પીણીનો) ત્યાગ કરવો જોઈએ. અને તે પછી પણ (તે દિવસે) શોકાતુર લોકો લે છે તેવો (એટલે કે તદ્દન સાદો) ખોરાક જ લેવો જોઈએ.

(મીઝાનુલ - હિકમત- ભા.૮. પા.૩૭૮૩)”

ઈમામે સાદિક અ.સ. ફરમાવે છે કે “આશૂરાના દિવસે પોતાના કાર્યોને ત્યજી દે અને પોતાના રોજુંદા કામોનો પણ ત્યાગ કરી દે (કેમકે બની ઉમર્યા તે દિવસને શુભ ગણતા હતાં) તો ખુદાવન્દે આલમ તેની દુન્યા અને આખેરતની જરૂરિયાતો (હાજતો) ને પૂરી કરશે અને જે વ્યક્તિ આશુરાના દિવસે શોકાતુર - શોકમગ્ન રહેશે તો કયામતના દિવસે ખુદાવન્દે આલમ સઘળા ભય અને બીક તેનાથી દુર કરી દેશે અને કયામતનો દિવસ તેના માટે ખુશી અને પ્રસન્નતાનો દિવસ હશે.”





# મજલિસોની વિશિષ્ટતાઓ

ઈરાનની ઈસ્લામી ક્રાંતિના રેહબરે મોઅઝઝમ હઝરત આયતુલ્લાહુલ ઉઝમા સૈયદ અલી ખામનાઈ મદેઝિલ્લાહુલ આલીએ પોતાના એક પ્રવચનમાં ફરમાવ્યું છે કે “કોઈપણ વ્યક્તિની દૃષ્ટીએ હુસૈન અ.સ.ની મજલિસોની ત્રણ ખાસીયતો-વિશિષ્ટતાઓ (લક્ષ્યો) હોવા જોઈએ.”

## ૧. અહલેબૈત અ.સ. પ્રત્યેના પ્રેમમાં મજબૂતાઈ

આપણી મજલીસો એવી હોવી જોઈએ કે જેમના થકી લોકોમાં અહલેબૈત પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ થાય. કેમકે પ્રેમ અને ભાતૃભાવનો સંબંધ મુલ્યવાન સંબંધ હોય છે. વિદ્વાનો (ઉલમા) અને મજલિસો પઢનારાઓ





(ઝાકીરો)ના પ્રવચનો થકી (લોકોના) અહલેબૈત પ્રત્યેના પ્રેમભાવ અને માઅરેફતે ખુદાવન્દી (અલ્લાહની સાચી ઓળખ)માં વૃદ્ધિ થાય, જો આપણી મજલિસોને કારણે કોઈ અપરિચિત (ગૈર) વ્યક્તિ અહલેબૈત અ.સ.ની સમીપ આવવાને બદલે (તેમનાથી) દૂર થઈ જાય તો આપણી મજલિસોને કારણે ફાયદો નહીં પણ નુકસાન થયું ગણાશે.

## ૨. કરબલાના પ્રસંગની હકીકત સ્પષ્ટ કરવી :

ઈમામ હુસૈન અ.સ.એ. સત્યને કાજે વિરોધ વ્યક્ત કર્યો હતો, તેના તથ્યો અને કરબલાના પ્રસંગના પરિબળો અને દ્યેયની જાણકારી આપણને ઈમામ હુસૈન અ.સ.ની મજલિસો થકી પ્રાપ્ત થવી જોઈએ, એવું ન થવું જોઈએ કે લોકો મજલિસોમાં હાજરી આપે અને ફક્ત રૂદન (ગિર્યા-વ-ઝારી) કરીને ચાલ્યા જાય અને કાંઈ પ્રાપ્ત ન કરે અને એટલું પણ ન જાણી શકે કે તેમણે આ રૂદન શા માટે અને કોના માટે કર્યું ? આપણે મજલિસોમાં શા માટે આવ્યા ? ઈમામ હુસૈન અ.સ. કરબલા કેમ આવ્યા





હતાં ? આશુરાનો બનાવ શા કારણે બન્યો હતો ? ઈમામ હુસૈન અ.સ. જે વિરોધ વ્યક્ત કરવા નિકળ્યા હતાં, તેનાં ધ્યેય અને લક્ષ્યાંકો શું હતાં ?

આપણી મજલિસોના વિષયો એવા હોવા જોઈએ કે જેથી આપણને ઉપરોક્ત જાણકારી પ્રાપ્ત થઈ શકે અને તે થકી લોકોને કરબલાના પ્રસંગની વાસ્તવિકતા અને સત્ય પરિસ્થિતિની જાણકારી મળી રહે.

### ૩. દીન અને ઈમાનમાં વૃદ્ધિ થાય :

આપણી મજલિસોની એક ખાસીયત એ પણ હોવી જોઈએ કે તેનાથી લોકોના ઈમાનમાં વૃદ્ધિ થાય અને દીન (ધર્મ)ની ખરી જાણકારી અને જાગૃકતા ઉદ્ભવે. મજલિસોની વિષય વસ્તુઓ અને વર્ણનમાં દીનના મર્મનું સ્પષ્ટીકરણ - કુરઆન અને હદીસોનું સાચું વિસ્તૃતીકરણ અને સ્પષ્ટતાઓ હોવાં જોઈએ.






## ઈમામ હુસૈન અ.સ.ની ઝિયારતનો સવાબ

શૈખ સદુકએ પોતાના પુસ્તક “અમાલી”માં અબ્દુલ્લાહ-બિન-ફઝલથી રિવાયત કરી છે કે :

હું એક દિવસ ઈમામ સાદિક અ.સ.ની પાસે હતો. ત્યારે તુસનો એક રહેવાસી ઘરમાં આવ્યો અને ઈમામ અ.સ.ને પુછ્યું “હે ફરઝન્દે રસુલ ! જે વ્યક્તિ ઈમામ હુસૈન અ.સ.ની કબર-મુબારકની ઝિયારત કરે તેના માટે શું સવાબ છે ?”

ઈમામ સાદિક અ.સ.એ ફરમાવ્યું, હે તુસના રહેવાસી ! જે કોઈ વ્યક્તિ ઈમામ હુસૈન અ.સ.ની કબર-મુબારકની ઝિયારત એ શ્રદ્ધા અને યકીન સાથે કરશે કે ઈમામ અ.સ.ની તાબેદારી અને આજ્ઞા પાલન વાજિબ (ફરજીયાત) છે એટલે કે ખુદાવન્દે આલમે સમગ્ર મનુષ્યજાતિ માટે ઈમામની તાબેદારી અને આજ્ઞાપાલન વાજિબ કર્યું છે. તો ખુદા તેના ભૂતકાળના અને ભવિષ્યના તમામ ગુનાહોને માફ કરી દેશે અને સીત્તેર ગુનાહગારો માટે તેની શફાઅત (અલ્લાહ કોઈના ગુનાહ માફ કરી દે તે અંગેની દુઆ) કબુલ ફરમાવશે અને ઈમામ હુસૈન અ.સ.ની કબર પાસે તે જેકાંઈ પણ માંગણી કરશે (હાજતની યાચના) તે પૂર્ણ કરશે. (અમાલીયે-સદૂક-ભા.૧૧ પ્રકરણ-૮૬ પા.નં. ૬૮૪)





## અઝાદારી - એક મહાન નેઅમત

નાનાજાન, આપની ઉપર આકાશના ફરિશ્તાઓ દુરુદ મોકલે છે અને આપનો આ હુસૈન અ.સ. છે, જે લોહીમાં તરબતર છે. અને તેનું શરીર ટુકડે ટુકડે થઈ ગયું છે. અને તેના અમામા (પાઘડી) અને રિદા (ખભે નાંખવાનો ખેસ) ઝુંટવાઈ ગયાં છે. (હઝરત ઝયનબ સલા.)

જો કોઈની પાસે કોઈ નેઅમત (બહુ-મુલ્ય વસ્તુ ખુદાની દયા-કૃપા) ન હોય તો તેની પાસેથી કોઈ હિસાબ લેવાશે નહીં. પરંતુ જો કોઈની પાસે (ખુદાએ આપેલી) કોઈ બહુમુલ્ય વસ્તુ (નેઅમત) હશે તો તે વ્યક્તિ પાસેથી તે નેઅમત અંગે હિસાબ અચુક લેવાશે.

આ નેઅમતોમાંથી એક અત્યંત મહાન નેઅમત અઝાદારી અને ઈમામ હુસૈન અ.સ.ની યાદ છે. આપણાં માટે-એટલે કે શીઆઓ માટે આ અઝાદારીની મજલિસો - આ મોહર્રમ માસ અને આ આશૂરાનો દિવસ (શોક પ્રદર્શિત કરવાના પ્રતિકો હોવા છતાં) ઈલાહી નેઅમતો છે. દુર્ભાગ્યે આપણાં બિન-શીઆ મુસલમાન ભાઈઓએ આ નેઅમતોમાં પોતાને સહભાગી નથી બનાવ્યા. તેઓ પણ આ મહાન નેઅમતોથી લાભાંવિત થઈ શક્યાં હોત.





આ મહાન નેઅમત મનને ઈમાનના મૂળ શ્રોત સાથે સાંકળી દે છે. આ નેઅમતે મહાન પરાક્રમ કરી બતાવ્યું છે કે ઈતિહાસના દરેક યુગમાં અત્યાચારપ્રિય શાસકોને આશુરા અને ઈમામ હુસૈન અ.સ.ની કબરની બીક રહી છે અને આવી રીતે બની ઉમય્યાના ખલીફાઓ (શાસકો)ના કાર્યકાળથી જ આ બીકનો આરંભ થઈ ગયો હતો અને આજ પર્યંત બાકી છે. જેનું એક દૃષ્ટાંત પહેલવી શાસન હતું કે મહોર્મની શરૂઆતની સાથે જ તેઓ (પહેલવી શાસકો) અત્યંત શક્તિહીન અને અસહાય-નિરાધાર થઈ જતા હતાં, અને તેથી ઈમામ ખુમૈની રહ. અત્યાચારી શાસનની આ પરિસ્થિતિનું વર્ણન કરતા ફરમાવતાં હતાં : “મહોર્મ એ મહીનો છે, જેમાં લોહીએ તલવાર ઉપર વિજય મેળવ્યો હતો. અને આ કરબલાની વિચાર સરણી અને જુસ્સાનું અનુસરણ કરીને જ ઈરાનની ઈસ્લામી ક્રાંતિ (ઈન્કિલાબે ઈસ્લામી-ઈશમ)ને સફળતા અપાવી હતી.”

સઘળા મુસલમાનો માટે એ જરૂરી છે કે તેઓ અઝાદારીથી આવી રીતે ફાયદો પ્રાપ્ત કરે. અઝાદારીમાં મન પરોવે. અઝાદારીની મજલિસો રાખે અને શક્ય તેટલી હદે આવી મજલીસોની સંખ્યા વધારતા રહે.

(રેહબરે મોઅઝઝમ - આયતુલ્લાહુલ - ઉઝમા - સૈયદઅલી ખામનાઈનો સંદેશ)





## ઉચ્ચ નૈતિકતાનું દૃષ્ટાંત

તાઉસે યમાનીએ રિવાયત કરી છે કે “મેં એક દિવસ મસ્જુદે હરામ (ખાનઅે કાઅબા)માં એક વ્યક્તિને જોયાં જે ખાનઅે કાઅબાની પરનાળની પાસે નમાઝ પઢતા હતાં અને ખુબ જ કાકલૂદી સાથે રડતાં રડતાં દુઆ કરતા હતાં. હું તેમની સમીપ ગયો તો જોયું કે તે અલી-ઈબ્નલ - હુસૈન અ.સ. (ઈમામ ઝૈનુલ આબેદીન અ.સ.) હતાં. મેં અરજ ગુજારી “હે ફરઝન્દે રસુલ સ.અ.વ.! આપ શા માટે આવી રીતે રડી - રડીને દુઆ કરો છો ? આપની તો ત્રણ એવી ફઝીલતો (વિશિષ્ટતાઓ) છે જેને કારણે આપને કોઈપણ બીક હોવી જોઈએ જ નહીં. પ્રથમ તો એ કે આપ પયગમ્બરે ઈસ્લામ સ.અ.વ.ના સુપુત્ર (વશંજ) છો, બીજુ એ કે આપને તો આપના નાના ની શિક્ષાઅત પ્રાપ્ત છે. અને ત્રીજું એ કે આપને પોતાને પણ ખુદાની કૃપા (ખુદાની રહમત) પ્રાપ્ત થયેલી છે.”



આપ. અ.સ.એ ફરમાવ્યું : તાઉસ ! હું પયગમ્બર સ.અ.વ.નો ફરજાન્દ છું તે મારા રક્ષણનું કારણ બની શકે નહીં કેમકે ખુદાવન્દે આલમે ફરમાવ્યું કે “ફલાઅન્સાબા બયનહુમ - યવમેએમ્મિન” અર્થાત “કયામતના દિવસે કોઈ પણ સગપણ લાભદાયી નહીં નીવડે” (સૂરએ મોઅમેનૂન-આયત-૧૦૨)

અને શક્ય છે કે મારા પિતામહની શફાઅત પણ મને રક્ષણ ન આપી શકે. કેમકે ખુદાવન્દે આલમ ફરમાવે છે કે “વલા-યશફૂઉના-ઈલ્લા-લમનિર્તમ્મા” અર્થાત “એ લોકો, ખુદાવન્દે આલમ જેનાથી રાજી ન હોય તેવી કોઈ વ્યક્તિની શફાઅત કરશે નહીં.” (સૂરએ-અંબિયા-આયત-૨૮)

અને અલ્લાહ પોતાની દયા-કૃપા (રહમત) વિષે પણ ફરમાવે છે કે :

**ઈન્ના-રહમતલ્લાહે કરીબુન-મિનલ-મોહસેનીન,**

અર્થાત : ખુદાની દયા-કૃપા (તો) ઉપકાર અને સદ્કાર્યો (નેકી) કરનારાઓની જ પાસે છે. (પ્રાપ્ત થશે.) (સૂરએ-આઅરાફ આયત-૫૫)


અને હે તાઉસ ! હું નથી જાણતો કે હું નેકી, સદ્કાર્યો કરનાર છું કે નહીં !

(મહજતુલ બયઝાઅ - ભા.૪ પા.નં.૨૮૧)

(આ પ્રસંગ ઉપરથી આપણને એવો બોધપાઠ મળે છે કે મનુષ્યએ કયામતના દિવસે સારો બદલો મેળવવો હોય તો પોતે જ સદ્કાર્યો કરીને પોતા માટે તેનો સંગ્રહ કરવો પડશે. બીજા પાસેથી (શિફાઅતની) આશા રાખી બેસી રહેવાથી તેને કોઈ ફાયદો થશે નહીં. દરેક મનુષ્ય પોતે જે કાંઈ કરશે તેનો અને તેટલા પ્રમાણમાં જ તેને તેનો બદલો મળશે.)







# ایستغفر اللہ

## તૌબા કરવાવાળાઓ જન્મતીઓ છે

મઆઝ-બિન-વહબ- કહે છે કે “એક વખત હું કેટલાક લોકો સાથે મક્કા-મોઅઝ્ઝમા જઈ રહ્યો હતો. એક ઘરડો વ્યક્તિ પણ અમારી સાથે હતો, પરંતુ અમારી જેમ અહલેબૈત અ.સ.ની વિલાયત અને હઝરત અમીર અ.સ.ને ખલીફાએ બિલા ફસલ માનતો ન હતો. તેથી જ પોતાના ખલીફાઓના મઝહબ પ્રમાણે પ્રવાસમાં પણ પુરી ચાર રકાત નમાઝ પઢતો હતો.

તેનો એક ભત્રીજો પણ અમારી સાથે કાફલામાં હતો પરંતુ તેનો અકીદો અમારી જેમ સિરાતે મુસ્તકીમ ઉપર હતો. તે વૃદ્ધ વ્યક્તિ માર્ગમાં બીમાર પડી

ગયો. તેના ભત્રીજાને થયું (વિચાર્યું) હું તેને વિલાયતની બાબતે જાણકારી આપું તો તે સાંઝં રહેશે. કદાચ ખુદાવન્દે આલમ તેના અંતિમ સમયે તેને સત્યના માર્ગ તરફ ફેરવી દે અને અસત્ય તેમજ પાપના માર્ગથી મુક્તિ અપાવી દે.”

કાફલાવાળા એકે કહ્યું “તેને તેના હાલ ઉપર જ રહેવા દો” પરંતુ તેનો ભત્રીજો તેની તરફ દોડ્યો અને તેને કહ્યું “હે કાકા, અમુક લોકો





સિવાય બાકીના ઘણાં બધાં લોકો હઝરત રસૂલે ખુદા સ.અ.વ. પછી અલ્લાહની આજ્ઞાના પાલનમાંથી ફરી ગયાં હતાં. પરંતુ રસૂલે ખુદા સ.અ.વ.ની જેમ હઝરત અલી - ઈબ્ને - અબીતાલીબ પણ “વાજિબુલ ઈતાઅત” (એવા વ્યક્તિ કે જેમની આજ્ઞાઓનું પાલન કરવું ફરજિયાત હોય) છે.”

પયગમ્બરે અકરમ સ.અ.વ. પછી હક (સત્ય) હઝરત અલી અ.સ.ના પક્ષે છે. અને તેમની આજ્ઞાઓનું પાલન કરવું સમગ્ર ઉમ્મત ઉપર વાજિબ (ફરજિયાત) છે. આ બોધ વચનો સાંભળી તે ઘરડો વ્યક્તિ જોરથી ચિત્કાર પાડી ઉઠ્યો અને કહ્યું “હું પણ આ અકીદો સ્વીકારું છું” આ શબ્દો બોલતાની સાથે જ તેના પ્રાણ પંખેરુ ઉડી ગયાં.

અમે પ્રવાસમાંથી પરત આવ્યાં પછી હઝરત ઈમામ જાઅફરે સાદિક અ.સ.ની પુણ્યશાળી સેવામાં પહોંચ્યાં. અલી-બીન-સરી એ તે વૃદ્ધ વ્યક્તિનો પ્રસંગ કહી સંભળાવ્યો. આ ઘટના સાંભળીને ઈમામ અ.સ.એ ફરમાવ્યું. “તે વ્યક્તિ જન્મતી છે.” અલી-બીન-સરી એ અરજ કરી કે “હે મોલા તે વ્યક્તિ તો તદ્દન અંતિમક્ષણે આ અકીદા ઉપર ઈમાન લાવ્યો હતો અને તદ્દન અંતિમક્ષણે તેનો અકીદો સાચો થયો હતો. શું આવો વ્યક્તિ પણ જન્મતી અને મુક્તિ પામેલો વ્યક્તિ છે ?” આ સાંભળીને ઈમામ અ.સ.એ ફરમાવ્યું “આના કરતા તમે વધારે શું ઈચ્છો છો. ખુદાના સમ ! તે સ્વર્ગના રહેવાસીઓમાંથી છે.”

(ઉસૂલે કાફી ભાગ-૨. પા-૪૪૧. હદીસ-૪)







## મોહર્રમ માસનું મહત્વ

- ★ મોહર્રમ એ મહિનો છે જેમાં ન્યાય એ અન્યાયનો સામનો કર્યો અને સાબિત કરી બતાવ્યું કે વિજય હંમેશા ન્યાયનો જ થાય છે.
- ★ મોહર્રમ એ મહિનો છે જેમાં યઝીદ જેવી તાકતો અને શૈતાની કાવતરાની હાર થાય છે.
- ★ મોહર્રમને જીવંત રાખો, અમારી પાસે જે કંઈપણ છે તે મોહર્રમ અને શહાદતે સૈયદુશશોહદા (અ.સ.)ના કારણે જ છે.






જેવી રીતે ઇમામ હુસૈન અ.સ. એ ખાલીફ હુકમરાન ની હુકુમત અને તેની નિતીઓ સામે વિરોધ દર્શાવ્યો હતો તેવી રીતે જ આપણે પણ આપણી જિંદગીમાં ઇમામ (અ.સ.)ની તાલીમ પર અમલ કરવો જોઈએ.

- ઇમામ (અ.સ.) અને અઝાદારી અમને ખાલીફોના વિરોધ અને મઝલૂમોની હિમાયતની સીખ આપે છે.

- (ઇમામ ખુમૈની ર.અ.)






## દુઆ કબૂલ થવાની શરતો

૯ - મુશ્કેલ પરિસ્થિતિ અને અમન ચેનની પરિસ્થિતિ-એમ દરેક પરિસ્થિતિમાં દુઆ કરતા રહેવું. ઈસ્લામની રિવાયતોમાં મુશ્કેલીઓ આવી પડી હોય તેવી પરિસ્થિતિ કરતાં સુખ-ચેન અને આરામ હોય, કોઈ ચિંતા કે અસુવીધા ન હોય તેવી પરિસ્થિતિમાં દુઆ કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ ફરમાવ્યું છે. “ તમો સુખ-ચેનમાં ખુદાને ઓળખો (ખુદાને યાદ કરો) તે તમારા મુશ્કેલીભર્યા સમયે તમારો ખ્યાલ રાખશે. તમારી ચિંતા કરશે.” ( એટલે કે તમારી મુશ્કેલીઓ સરળ કરી દેશે.) (વસાએલુશીઆ-ભા-૪-૧૦૯૭-હદીસ-૮૬૭૨)

હઝરત ઇમામ સાદિક અ.સ. થી રિવાયત છે કે “ જે વ્યક્તિઓ મુશ્કેલીભર્યા કામમાંથી પસાર થઈ રહ્યા હોય તે છતાંયે તે દુઆને પ્રાધાન્ય આપે (દુઆ- અલ્લાહ પાસે યાચના કરતા રહે.) તો તેની દુઆ કબૂલ થશે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ( એવા સમયે દુઆ કરતી વખતે ) તેના અવાજમાં એક વિશિષ્ટ પ્રકારની







કાકલુદી હોય છે. જેના માર્ગમાં આકાશ  
પણ વિઘ્નકર્તા બનતા નથી અને જે વ્યક્તિ  
પોતાના સુખ-ચેન-આરામના સમયે દુઆને  
પ્રાધાન્ય નથી આપતો (અલ્લાહ પાસે  
કરગરવા-ચાચના કરવાને જરૂરી નથી  
સમજતો) તેવા વ્યક્તિએ તેના મુશ્કેલીભર્યા  
કામમાં કરેલી દુઆઓ કબૂલ નથી થતી.  
અને ફરિશ્તાઓ કહે છે કે આ અવાજ તો  
અમારો પરિચિત (નો) અવાજ છે જ નહિ”

(વસાએલુશીઆ-ભા-૪-૧૦૯૬- હદીસ-૮૬૬૪)

ઇમામ સાદિક અ.સ.નો કથન છે કે જો કોઈ વ્યક્તિ એમ ઇચ્છતો હોય  
કે મુશ્કેલીભર્યા સમયે તેની દુઆઓ કબૂલ થાય તો તેણે પોતાના એશ  
આરામના સમયે પણ અલ્લાહની બારગાહમાં કરગરવા સાથે દુઆ કરવી  
જોઈએ.” (વસાએલુશીઆ-ભા-૪-૧૦૯૬-હદીસ-૮૬૬૦)

અને આપ અ.સ.નો જ ફરમાન છે કે દુઆ કરવામાં જલ્દી કરતાં રહો  
કેમકે જે બંદો ખુબ જ વધારે પ્રમાણમાં દુઆ કરતો હોય અને તે જ્યારે  
મુસીબતોમાં ઘેરાઈ જાય ત્યારે તેને કહેવામાં આવે છે કે આ તો જાણીતો અવાજ  
છે. ( તેની દુઆ કબૂલ કરવામાં આવે.) અને જ્યારે તે (પોતાના સુખ શાંતિના  
સમયમાં) વધારે દુઆ કરતો હોતો નથી અને મુસીબતો આવી પડે ત્યારે તે દુઆ







કરે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે (હવે દુઆ કરે છે.) આના પહેલા તું ક્યાં હતો ? (વસાએલુશીઆ ભાગ-૪-૧૦૯૬ હદીસ ૮૬૬૭)

મનુષ્યના જીવનના કોઈપણ કાર્યમાં તેની પધ્ધતિ આવી જ હોવી જોઈએ. અને મનુષ્ય જેટલા વધારે પ્રમાણમાં અલ્લાહની બારગાહમાં દુઆ કરતો રહેશે તેનું મન પણ અલ્લાહની બારગાહમાં એટલા જ વધારે પ્રમાણમાં સમર્પિત થશે અને તે

અલ્લાહની એટલા પ્રમાણમાં બંદગી કરવા માટે પ્રેરાશે. તેથી જ્યારે મનુષ્ય મુસીબતોમાં ઘેરાઈ જશે ત્યારે તેનું મન (અગાઉથી જ) અલ્લાહની બારગાહમાં સમર્પિત હશે. અને આ સંજોગોમાં દુઆ કરશે તો તેની દુઆ તરત જ કબૂલ થશે અને તેવા સંજોગોમાં તેની દુઆ અને તે દુઆના કબૂલ થવાની વચ્ચે કોઈપણ અડચણરૂપ બની શકશે નહિ. અબુ જાફર અ.સ.ની રિવાયત છે કે મોમીનોએ મુશ્કેલીઓના અને સુખ શાંતિના બંને સમયગાળામાં એક સરખી રીતે દુઆ કરતાં રહેવું જોઈએ. એમ નહિ કે ખુદાની નેઅમતોના સંજોગોમાં દુઆ કરવામાં આઠસ કરો. તેથી દુઆ કરવામાં થાકવું જોઈએ નહિં કેમકે દુઆનું સ્થાન ખુદાવન્દે આલમની પાસે છે.

(વસાએલુશીઆ ભાગ-૪-૧૧૧૧-હદીસ-૮૭૨૯)







## ખુદાની દયા-કૃપા (રહમત)ના અધિકારી લોકો

રસુલે અકરમ સ.અ.વ.નું ઇશાદ છે કે,

તેમના માટે બીજો કોઈ આશ્રયદાતા નહીં હોય તેવા દિવસે સાત પ્રકારના લોકો ખુદાવન્દે આલમની દયા-કૃપા (રહમત)ની છત્રછાયા તળે હશે.

- (૧) ન્યાયકર્તા આગેવાન (ઈમામે આદિલ)
- (૨) એવો યુવાન કે જેનો ઉછેર ઈબાદતે ઈલાહીમાં જ થયો હોય. (એટલે કે જે બાલ્યાવસ્થાથી જ ઈબાદતે ઈલાહીમાં મશગુલ રહ્યો હોય)
- (૩) એ વ્યક્તિ કે જેનું મન મસ્જિદોમાં જ ચોટેલું રહેતું હોય.
- (૪) ખુદાવન્દે આલમના કાજે એક બીજા સાથે પ્રેમ કરનારાઓ કે જેઓ તેના (ખુદાના) કાજે જ એકત્ર થાય અને તેના કારણે જ એકબીજાથી વિખુટા પડે. (એટલે કે તેમની મિત્રતા અને દુશ્મની ખુદાના કાજે જ હોય)
- (૫) જે વ્યક્તિ એવી ગુપ્ત રીતે સદકો (દાન) આપે કે એક હાથે આપે તો બીજા હાથને પણ તેની જાણ ન થાય.
- (૬) જે એકાંતમાં ખુદાનો ઝિક્ર કરતો હોય (એટલે કે કોઈ જોનાર ન હોય તે સંજોગોમાં) ત્યારે પણ તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે.
- (૭) એવો પુરુષ કે જેને કોઈ અત્યંત સૌંદર્યવાન અને સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતી સ્ત્રી આમંત્રણ આપે અને તે એ સ્ત્રીને એવું કહીને તેના (પાપ-અનૈતિક કાર્ય માટેના) આમંત્રણને હુકરાવી દે કે તે ખુદાથી ડરે છે. (સહીહ બુખારી-પ્રકરણ-૮-સહીહ મુસ્લિમ પ્રકરણ-૩૦-ઝિમ્મુલહવા-નામના પુસ્તકમાંથી અવતરણ-પા.નં.૨૪૩)







# આશૂરા

## - એક સૌથી મુશ્કેલ કસોટી

આશુરાનો એક પદાર્થપાઠ એ પણ છે કે તેણે લોકોને બે સમૂહોમાં વિભાજિત કરી દીધાં. (દરેક પરિસ્થિતીમાં સત્યનો સાથ આપનારાઓ અને સત્યને ઓળખીને પણ તે માર્ગની મુશ્કેલીઓથી વિચલિત થઈને સત્યનો સાથ

નહીં આપનારાઓ - એવા બે સમૂહો.)


કૂફાની અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને શ્રીમંતોએ ઈમામ હુસૈન અ.સ. મદીનાથી રવાના થઈ ચુક્યા હતાં તે સમયે ઈમામ હુસૈન અ.સ.ને પત્રો લખીને કૂફા આવવા આમંત્રણ આપ્યા હતાં.

શું લોકોને જાણકારી હતી ! પરિસ્થિતિ શું હતી ?

તેઓને કલ્પના પણ નહોતી કે (ઈમામ હુસૈન અ.સ.નો સાથ આપીને) એક અત્યંત સખ્ત કસોટી અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતીઓમાંથી પસાર થવું પડશે. મક્કાથી ઘણા લોકો ઈમામ અ.સ. સાથે નીકળ્યા હતાં. પરંતુ એમને જાણકારી નહોતી, આ કાર્યનું પરિણામ શું આવશે. જોકે દેખીતી રીતે માર્ગ કંટકોથી ભરેલો ભાસતો હતો પરંતુ (તે લોકો) ખરી પરિસ્થિતીથી અજાણ હતાં. પરંતુ જેમજેમ ધીમે ધીમે હકીકત (કે ઈમામ અ.સ. સત્તા મેળવવા માટે યુદ્ધ કરવા નીકળ્યા નથી) ની જાણ તેમને થતી ગઈ તેમતેમ દીનદાર (ધર્મનિષ્ઠ) વ્યક્તિઓની સંખ્યા ઓછી થવા લાગી. મુશ્કેલીઓએ દુન્યાના ચાહવાવાળાઓને વિચલીત કરી દીધાં. જેમકે ઈમામ પોતે જ ફરમાવે છે કે જ્યારે








મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે ધર્મનિષ્ઠ (દીનદાર) લોકોની સંખ્યા ઓછી થવા લાગે છે અને જ્યારે સુખચેન હોય છે ત્યારે (સાથ આપવાનો) દાવો કરનારાઓ ઘણા હોય છે. પરિસ્થિતિ તદ્દન આ પ્રકારે જ હતી. તે સમયે મક્કા-મદીના-ફૂફા અને સમગ્ર મુસ્લીમ જગતમાં દીનના અનુયાયી હોવાનો દાવો કરનારા અને લેશમાત્ર પણ પાછી પાની કર્યા વગર તેઓ દીનની આજ્ઞાઓનું પાલન કરનારા

વ્યક્તિઓની સંખ્યા ઘણી મોટી હતી. ઘણાં લોકો હુસૈન-ઈબ્ને-અલી અ.સ.ને ફરઝાન્દે રસૂલ સ.અ.વ. તરીકે માનતા હતાં અને તેમનાથી પ્રેમ પણ કરતાં હતાં. પરંતુ જ્યારે ઈમામ હુસૈન અ.સ. મક્કાથી નીકળ્યા તો તેમનામાંથી ઘણાખરાં આપનો સાથ આપવા તૈયાર નહોતાં. આપ એવું ન વિચારતા કે ઈમામ હુસૈન અ.સ.નો સાથ નહીં આપનારા ગણમાન્ય અને મહત્વના લોકો ઈમામ હુસૈન અ.સ.ને ઈમામ નહોતા માનતાં-ના, એવું નહોતું !!! આ બધા ઈમામ હુસૈન અ.સ.ને ઈમામ તો સ્વીકારતાં જ હતાં. આપને રસૂલ સ.અ.વ.ના ફરઝાન્દ અને એક અતિ ઉચ્ચ મહાન વ્યક્તિ પણ માનતા હતાં. તેમ છતાંયે તેઓ ઈમામ હુસૈન અ.સ.નો સાથ આપવા તૈયાર ન થયાં. કેમકે ઈમામ હુસૈન અ.સ.ને સાથ આપવો તે એક અત્યંત દુષ્કર અને કઠણ કામ હતું !

(રેહબરે-મોઅઝ્ઝમ-આયતુલ્લાહુલ-ઉઝમા-સૈયદ અલી ખામનાઈનો સંદેશ)







# ઈસ્લામના અહકામનું શિક્ષણ

(હપ્તો પહેલો)


## અહકામ :

ઈસ્લામની આજ્ઞાઓને ત્રણ વર્ગમાં વહેંચી શકાય.

૧. અકાઈદ-ધાર્મિક માન્યતાઓ એટલે કે ઉસ્લૂલે દીન
૨. અહકામ-આજ્ઞાઓ-એટલે ફુરુએ દીન
૩. અખલાક-એટલે કે શિષ્ટાચાર

## ફુરુએ દીન :

આ અમલ કરવાની આજ્ઞાઓનો સંપુટ છે. જેમાં મનુષ્યની ફરજો સુનિશ્ચિત થયેલી છે કે તેણે કયા કાર્યો કરવા અને કયા કાર્યો ત્યાગવા. આ સંવિધાન ને “અહકામ” કહેવામાં આવે છે. અને આ અહકામની જાણકારી મેળવવા માટે તકલીદ (અનુકરણ) અને કોઈ (જાણકાર)





મુજતહિદનું અનુસરણ કરવામાં કોઈ વાંધો નથી.

## અહકામનું વર્ગીકરણ :

મનુષ્ય જે કાંઈ પણ કરે છે તેના માટે ઈસ્લામમાં એક ચોક્કસ આજ્ઞા મોજુદ છે અને આ આજ્ઞાઓ નીચે મુજબ છે.

૧. વાજીબ :- એવા કાર્યો જે કરવા ફરજીયાત છે અને તેમને ન કરવાથી અઝાબ છે. જેમકે નમાઝ, રોઝા વિ.


૨. હરામ :- એવા કાર્યો જે કરવાની બાબતે નિષેધ (મનાઈ) છે. જેમને ત્યાગવા ફરજીયાત છે અને આવા કાર્યો કરવાથી અઝાબ છે. જેમકે : જુઠ, અત્યાચાર વિ.

૩. મુસ્તહબ :- એ કાર્યો કે જે કરવા સારા અને તે કરવાથી સવાબ છે. પરંતુ ન કરવામાં આવે તો તેનાથી અઝાબ નથી દા.ત. નમાઝે શબ, સદકો વિ.

૪. મકરૂહ :- એવા કાર્યો જે ન કરવા સારા અને તેમને ન કરવામાં સવાબ છે. પરંતુ તેમને કરવાથી અઝાબ નથી. જેમકે ખાવા પીવાની વસ્તુઓ પર ફૂંક મારવી અથવા ગરમ-ગરમ ભોજન લેવું વિ.

૫. મુબાહ :- એવા કાર્યો - જેમનું કરવું - ન કરવું ત્યાગવું, બંને સમાન છે. એટલે તેમના કરવા ન કરવામાં ન તો કોઈ સવાબ છે અને ન તો કોઈ અઝાબ જેમકે ચાલવું, બેસવું વિ.


(વધુ આવતે અંકે)





# આઈ ગેલેશી


વહાલા બાળકો, મોહરમ નિમિત્તે આપેલા ચિત્રોમાં રંગ પૂરીને સુંદર બનાવો.















# બાળકોની કાર્યરી

વહાલા બાળકો, આ પાનું તમારું રહેશે. તમે કોઈ ધાર્મિક વાર્તા, કાવ્ય પંક્તિ, ચિત્ર કે દુયકો વિગેરે મોકલશો. જેથી તમારું પોતાનું આ પાનું ભર્યું ભર્યું રહે !

સાથે આપનું નામ, સરનામું, ઉંમર લખવાનું ભૂલતા નહીં !



હિરાણી મહમદ તકી આર.  
રાજુલા સીટી.



અમીરી સકિના શબ્બીરઅલી  
રાજુલા સીટી.



હસનરઝા અલીનકી રાજાણી  
ભાવનગર.



રવજાણી અફઝલ અબ્બાસ  
રાજુલા સીટી.





◀ મિઠવાણી સજ્જાદરઝા હબીબઅલી  
રાજુલા સીટી.

હુસૈનરઝા અલીનકી રાજાણી  
ભાવનગર.



◀ સૈયદા એલીયા ખુતુલ  
અમરેલી.

મિઠવાણી સજ્જાદરઝા હબીબઅલી ▶  
રાજુલા સીટી.





## કાણોદર ખાતે આગામી ૫૦ મો અઝાદારીનો કાર્યક્રમ

તારીખ ૨૬ ડીસેમ્બર ૨૦૧૩ ગુરુવારથી ૨૯ ડીસેમ્બર ૨૦૧૩, રવિવાર

દરમિયાન હુસૈન ટેકરી કાણોદર ખાતે રાખવાનું નક્કી કરેલ છે.

તમામ અઝાદાર ભાઈ-બહેનોને પ્રોગ્રામમાં શિરકતની ગુઝારીશ કરીએ છીએ.

### ખાસ નોંધ :

સભ્ય તથા એજન્ટ મિત્રોને નમ્ર અરજ છે કે જેનું અગાઉનું લવાજમ બાકી છે તે અને નવા વર્ષનું લવાજમ મોકલી આપવા વિનંતી.

### "હાદી" માસિકના મેમ્બર બનવા માટે સંપર્ક કરો :

અમદાવાદ	: (૧) શબ્દીરભાઈ નુરાની ફોન : ૯૩૭૬૧ ૬૮૩૦૬ (૨) મોલાના ઝફરુલ હસન ફોન : ૯૩૨૭૫ ૩૬૬૩૮ (૩) ઝાકીરભાઈ મોમીન ફોન : ૯૩૨૭૦ ૪૧૩૧૪
ભાવનગર	: મુસ્તાકભાઈ વિરાણી ફોન : ૯૮૨૪૫ ૩૮૧૧૪
મહુવા	: મેહદીરઝા એમ. ભંભેરા ફોન : ૯૯૨૪૩ ૨૭૨૨૭
કાણોદર	: નૌશાદભાઈ, જફરી ચેનલ ફોન : ૯૯૯૮૭ ૭૩૬૧૧
મેતા	: મોહસીનભાઈ કડીવાલ ફોન : ૯૮૯૮૩ ૬૯૦૮૯
ભરૂચ	: મુશ્તાકઅલી પાનવાલા ફોન : ૯૮૨૪૨ ૪૩૦૫૧
સેલવાસા	: ગુલામ અબ્બાસભાઈ દેવજાણી ફોન : ૯૮૨૫૯ ૯૯૯૭૮
ધોળકા	: કમરઅલીભાઈ મોમીન
ડેડીયાપાડા	: રિઝવાનહુસૈન અમીરઅલી રાજાણી ફોન : ૯૪૨૭૧ ૭૫૨૩૧
રાજૂલા	: મોલાના હસન મહદી ફોન : ૯૯૦૪૧૪૬૧૧૦
સિહોર	: હસનઅલી વજુરઅલી વસાયા ફોન : ૯૮૭૯૯૬૯૮૬૮
અંજાર	: રફીકભાઈ ખોજા ફોન : ૯૯૨૫૩ ૧૮૬૨૧
કચ્છ	: મુશ્તાક હુસૈન અબ્દુલ હુસૈન માસ્ટર ફોન : ૯૮૨૪૨ ૧૬૪૭૦
રૂસ્તમપુરા	: સૈયદ આશીક હુસૈન ફોન : ૯૮૨૪૧ ૧૯૩૭૨
મુંબઈ	: અલઈમાન બુક સેન્ટર (પાલાગલી) ફોન : ૯૮૧૯૦૧૦૨૨૮
ટુરીંગ એજન્ટ	: શબ્દીરઅલી હસનઅલી પ્રમાણી ફોન : ૯૪૨૬૪ ૬૧૪૯૨



# عبدالرحمن رسالة

HADDI MASIK

: Publishers :

**Hauza-e-Ilmiyah Imam Khomaini (R.A.)**

Goldenpark, Vatva, Ahmedabad. (Guj.) INDIA - 382440.

Ph. : 079 - 25892786, +91-94266 78614, +91-94266 78612

E-mail : [hadimasik@yahoo.com](mailto:hadimasik@yahoo.com)

Website : [www.hadikids.org](http://www.hadikids.org)

Printed by : PRINTWELL PRINTERS, Ahmedabad. (M) 9898001474

